# CRESTCHEM LIMITED

Reg. office: Sr. No. 550/1, Sub Plot o. 12, Village Indrad, Taluka -Kadi, District- Mehsana, Pin code-382715, Gujarat. Phone: +91-9409119484, Email: info@crestchemlimited.in GST Number: 24AAACC8722C1Z5 CIN NO. L24100GJ1991PLC015530/WEBSITE: www.crestchemlimited.in

09/02/2022

To,

The Bombay Stock Exchange Ltd.
The Department of Corporate Services,
Phirozleejeebhoy Tower,
Dalal Street,
Mumbai -400001

BSE Code - 526269

Dear Sir,

Sub.: Announcement under Regulation 30 (LODR) - News Paper Publication

With regard to captioned subject, we enclosed herewith copy of e-newspaper of Extract of Unaudited Standalone Financial Results of the company for the quarter ended December 31, 2021 which has been published on Lokmitra Gujarati (Gujarati News paper) and Freepress Gujarat (English Newspaper) February 9, 2022
Yours Truly

Shirt Mas

For, Crestchem Limited M

Company Secretary

Acs25742

# વજુભાઈ વાળા : અંદાજપત્ર રજૂ કરનાર નાણામંત્રીનો રેકોર્ડ અકબંધ

ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ સમય અંદાજપત્ર રજૂ કરવાનો એક અનોખો વિક્રમ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે.નાણામંત્રી વજુભાઈ વાળાએ સૌ પ્રથમ ૧૯૯૬-૯૭માં અંદાજપત્ર રજૂ કર્યું હતું . વિધાનસભાની તવારિખ જોઇએ તો અત્યાર સુધીમાં ૧૫ નાણાંમંત્રીઓએ અંદાજપત્ર રજૂ કર્યા છે. સૌ પ્રથમ અંદાજપત્ર ૨૨ ઓગસ્ટ, ૧૯૬૦માં સ્વ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. જે ૧૧૪ કરોડ રૂપિયાનું હતું. સ્વ. જીવરાજ મહેતા અને અરવિંદ સંઘવી એ ચાર-ચાર વાર અંદાજપત્ર રજૂ કર્યું હતું. સ્વ. માલદેવજી ઓડેદરા, મનોહરસિંહ જાડેજા, બાબુ મેઘજ શાહ, વિજયકુમાર ત્રિવેદીએ એક-એક વાર અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ ઉપરાંત માધવસિંહ સોલંકી, દિનેશ શાહ, બાબુ.જે. પટેલ, કાંતિલાલ ધિયા વગેરેએ પણ એકવાર

અંદાજપત્ર રજૂ કર્યું હતું. અંદાજપત્રની રસિક તવારિખોમાં બે ઘટનાઓ અભૂતપૂર્વ કહી શકાય તેવી છે. ૯૫-૯૬ માં નાણાંમંત્રી સુરેશચંદ્ર મહેતા તેમનું અંદાજપત્ર પ્રવચન વાંચતા વાંચતા થાક અનભવવા લાગ્યા હતા. તેમનં અધુરૂ પ્રવચન તે વખતે નાયબ નાણાં મંત્રી હેમંત ચપટવાલાએ આગળ વાંચીને પૂર્ણ કર્યું હતું.

અમદાવાદ, હાર્દિક પટેલે પત્ર લખીને કહ્યું કે, સામાન્ય રીતે તો



કનુભાઈ દેસાઇ

આનાથી પણ એક વિરલ ઘટના આ નાણાંકીય વર્ષ દરમિયાન એ વખત લેખાનુદાન પસાર કર્યા બાદ ૧૫-૮-૮૦ ના રોજ તત્કાલિન નાણામંત્રી સનત મહેતાએ સુધારેલું

મહેતાએ દ૯ પાનાનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેનો પ્રથમ ભાગ ૫૫ પાનાનો હતો. અને બીજો ભાગ ૧૪ પાનાનો હતો. જે સૌથી લાંબુ પ્રવચન

અંતરાય ઊભો કરવાનો એક જ બનાવ ગુજરાત વિધાનસભામાં નોંધાયો છે. ૮૧-૮૨ના વર્ષ માટે તત્કાલિન નાણામંત્રી સનત મહેતા એ શરૂ કર્યું, ત્યારે વિપક્ષ નેતાએ

રાજકોટમાં પોલીસ વિરુદ્ધ લોકદરબાર કરે

તો ફરિયાદોનો રાફડો ફાટે : હાર્દિક પટેલ

ધરાર કરાવી લેવા, મકાનો સોસાયટીઓ ખાલી કરવામાં

કર્યું. તેમણે પોતાનું નિવેદન ચાલુ રાખતાં અધ્યક્ષે વિપક્ષના નેતાનું રાખતા અધ્યક્ષ વિપક્ષના નતાનુ નિવેદન ગૃહની કાર્યવાહી નો ભાગ બનશે નહી તેવા મતલબની જાહેરાત કરી હતી. તે દરમ્યાન વિપક્ષી સભ્યોએ ગૃહમાં ધુન શરૂ કરી, સભાત્યાગ કરી ગયા હતા. આ પછી અંતરાયો ઊભો કરવાની એક સપ્તાહ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. મંત્રી મંડળમાં ફેરફાર થવાથી જૂના મંત્રીના બજેટમાં ફેરફારની ઘટના ૧૯૮૫માં અને ૧૯૯૪માં બની હતી. મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું અવસાન થતાં અંદાજપત્ર

લેખાનુદાન દ્વારા પસાર કરાયું હતું

કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટમાં ચાર્જ લીધા બાદ

### સરતના સાયણમાં સીએનજી પંપ પર મહિલાએ ધમાલ મચાવી તોડફોડ કરી

સુરત, સુરત જિલ્લાના સાયણના પેટોલ-સીએનજી પંપ પર ગેસ ફીલિંગને લઈ કારમાં સવાર મહિલાએ ધમાલ મચાવી કર્મચારીને તમાચો માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ફોન કરી માણસો બોલાવો પંપના ૩-૪ કર્મચારીઓ પર હુમલો કર્યા બાદ પથ્થરમારો કરી તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે આ પ્રકરણમાં પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પંપનો કર્મચારી એ જણાવ્યું હતું કે, તેઓ અમરોલી વરિયાવ ગામના નાના માછીવાડમાં રહે છે. એક ઈકો કારમાં એક યુવક અને તેમની સાથે આધેડ વયની મહિલા કારમાં ગેસ પુરાવવા મીએનજી કીલીંગ સ્ટેશન ખાતે આવ્યા સાંગળ કરાતા વાસ વિધાન હતા. દરમિયાન ઈકો કારના ચાલકે ગેસ પુરવા બાબતે પંપના ફીલર અમરત માછી સાથે બોલાચાલી કરી હતી અને કારમાં હાથ ધરી છે.

બેસેલી આધેડ વયની મહિલાએ કારમાંથી નીચે ઉતરી વિજયને તમાચો મારી દીધો હતો. વધુમાં જણાવ્યું મામલો ઉગ્ર બનાવી કાર ચાલકે ફોન કરીને તેના મિત્રોને બોલાવી લીધા કરાપ તેપા ભિતાપ ખાલાવા લાવા હતા. જેથી ફોન ઉપર કાર ચાલકના સાતેક જણા પંપ ઉપર ધસી આવ્યા હતા અને પંપના કર્મચારી શૈલેષ પટેલ, લિજય માછી, બુદ્ધિવલાસ યાદવ, રામબાબુ યાદવ અને રાજ માછી ઉપર સ્ટીલના ડસ્ટબીન અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે હુમલો કર્યો હતો. વધુમાં ઉમેર્યું હતું કે હુમલાખોરોએ સીએનજી પંપની બાજુમાં મુકેલા પે–એટીએમનું બોર્ડ તથા ખુરશીઓ, પેટ્રોલ ડિઝલ યુનિટમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ કરતા અમરોલી પોલીસે કાર ચાલક, તેની સાથે આવેલી આધેડ વયની મહિલા અને ફોન ઉપર બોલાવેલા સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ

## એક લાખ વૃક્ષોની વચ્ચે વનવગડો નર્મદામાં વનરાજી વચ્ચે હોમ સ્ટે પ્રોજકેટ

રાજપીપળા, સરકાર દ્વારા છે. આજે એક આદિવાસી સ્થાનિક પ્રવાસીઓને નર્મદા જિલ્લાની સંકૃતિ શિક્ષિત યુવાન પોતાની જમીનમાં આદિવાસી વિસ્તાર નું ટ્રાઇબલ ફૂડ અને કુદરતી વાતાવરણ મળે એટલે હોમ સ્ટે પ્રોજેક્ટ અમલ માં મુકી જે આ હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ જોડાય એટલે તેમને સલાહ અને જરૂરી મદદ સરકારે નક્કી કરેલી એજન્સીઓ હ્વારા આપવામાં આવતી હતી. પરંતુ પોતાની રીતે પોતાની યથા શક્તિ પ્રમાણે સાકવા અને ભીલવાસી ગામની વચ્ચે પોતાની જમીનમાં જ એક રિસોર્ટ ટાઈપ હોમ સ્ટેનું નિર્માણ એક આદિવાસી શિક્ષિત યુવાને કર્યું. આજે નર્મદા જિલ્લામાં સૌથી આકર્ષણ રૂપ બની ગયું છે. એક લાખ વૃક્ષો વાવી જેની વચ્ચે વિવિધ ડિઝાઇનના રૂમો બનાવી એક શુંદર લૂક આપ્યું દેશી વિદેશી પક્ષીઓ આવતા ગયા અને અહીંયા હજારો પશુપક્ષીઓ થઇ ગયા. સાથે નર્મદા જિલ્લાનું દેશી ઓર્ગેનિક ફૂડ શુદ્ધ શાકાહારી ભોજન સાથે લોકોની શાકાહારા ભાજન સાથ લાકાના પસંદગીનું ઉત્તમ સ્થળ બનતું ગયું અને હવે તેના સુંદર લૂક અને વિવિધ લોકેશન ને લઈને મેરેજ ડેસ્ટિનેશન, શ્રિ વેડિંગ સુટીંગ અને બથીડે સેલિબ્રેશન માટેનું આકર્ષણ ખુબ વધ્યું

શિક્ષિત યુવાન પોતાની જમીનમાં હોમ સ્ટે બનાવી એક સારી આવક મેળવતા થયા છે. આ બાબતે વગડો" હોમ સ્ટેના મુખ્ય નિર્માતા ઉત્પલભાઈ પટવારી તાલુકાના સકવા ગામમાં ખુબજ અંતરિયાળ જમીન નો એવો ઉપયોગ કર્યો અને છેલ્લા પાંચ વર્ષથી ધીરે ધીરે સતત આ પ્રોજેક્ટ પર ધ્યાન આપી એક રિસોર્ટ ટાઈપ લૂક બનાવ્યું કે આજે એક ફાઈવ સ્ટાર હોટેલ ને પાછળ પાડી દે છે. અહીની સૌથી સારી ખાસિયત કુદરતી સૌદર્ય અને દેશી ફૂડ સાથે હો મસ્ટેની આજુબાજુમાં જ ઉગાડવામાં આવે છે. જેમાંથી તાજું ફડ તૈયાર કરવામાં આવે છે અમારા વિસ્તારમાં ૧ લાખથી વધુ વૃક્ષો છે. હજારો પશુ પક્ષીઓ તેમાં વસવાટ કરે છે. કુદરતી વાતાવર વચ્ચે પ્રવાસીઓને પ્રકૃતિનો આનંદ મળે છે. પ્રવાસીઓની માંગ પ્રમાણે ફેરફાર પ્રવાસાઓના માંગ પ્રમાણ ફરફાર પણ કરી રહ્યા છે. દેશી ઓર્ગેનિક ફૂડસાથે મેરેજ ડેસ્ટિનેશન, પ્રિવેડિંગ સુટીંગ અને બધેંડે સેલિબ્રેશન માટે સૌથી વધુ લોકો અહીંયા આવે છે અને ખુશ થઈને જાય છે.

# ભાજપે પોલીસને કલેક્શનનો ટાર્ગેટ આપ્યો છે : જગદીશ ઠાકોર રાજકોર, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાજપુના પારાસભ્યએ જ પાર્ટીની બાદ કંઈક અલગ જ સ્થિતિનું નિર્મા

પાંક્સ પ્રમુખ જગદીશ ઠાકોર, ઉપરાંત અગ્રણી નેતાઓ હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ધોરાજીના એમએલએ લલિત વસોયા સહિતનાએ ઉગ્ર લાલા પસાવા સાહાગાએ ઇશ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. જગદીશ ઠાકોરે તો ત્યાં સુધી કહ્યું છે કે ભાજપની સરકારમાં પોલીસને કલેક્શન માટે ટાર્ગેંટ અપાયો છે, જ્યારે ઈન્દ્રનીલે સણસણતો આક્ષેપ કર્યો છે કે અગાઉ આ જ પોલીસ કમિશનર અગ્રવાલ નીતિન ભારદ્વાજના ઘરે જઇ પગે પડતા હતા. ભાજપના જ એમએલએ ગોવિંદ પટેલના લેટરબોમ્બ પર કોંગ્રેસ હવે અાકમક બની છે. રાજકોટના પોલીસ કમિશનર કમિશન લેતા હોવાના ગંભીર આક્ષેપ ખુદ ભાજપના જ ધારાસભ્ય અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપે પોલીસને ટાર્ગેટ આપ્યો છે. આ કેસમાં

ભાજિયમાં વારાસાન્યન જ પાદરાય ન્યાટ ૩૦૦ ગામ જ હારા પાસે બોલી છે. તમને બધાં કનેકશન પામ્યું છે. ગૂહમંત્રીની દાનત સાચી તાત્કાલિક મળી જાય છે તો પૈસા હોય તો રાજકોટમાં લોકદરભારનું ઉધરાવવામાં કેમ કોઈ કનેકશન આયોજન કરીને ભારાવે. આ નીકળતું નથી. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું હતું કે હાલમાં ભાજપ સરકાર સામે ભાજપના જ રાજકોટના બે ધારાસભ્ય એમાં પણ એક મંત્રી અને રાજ્યસભાના સાંસદ ખુલીને ભ્રસ્ટાચારનો આક્ષેપ કરી રહ્યા છે તેમ છતાં સરકાર એક્શનમાં આવતી નથી અને એના નીચલા આવતા નથા અને અના નાયલા અધિકારીને તપાસ સંપી ભીનું સંકેલવા માગે છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા એ સમયે આ કમિશનરની રાજકોટમાં નિમણુક કરવામાં આવી હતી, આ સમયે કમિશનર નીતિન ભારઢાજના પગ પકડવા તેમના ઘરે જતા હતા. હાર્દિક પટેલે પત્ર લખીને કહ્યું છે કે રાજકોટમાં અમુક અધિકારીઓનું આગમન થયા

લો કદરબારમાં તેમની જ પોલીસ સામે ફરિયાદોના રાફડો ફાટશે અને પોલીસની પોલ છતી થશે. રાજકોટના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ ખુલ્લા પડી જશે. ક્રાઈમરેટ ઘટાડવાના ચક્કરમાં સામાન્ય લોકોને ફરિયાદ નોંધાવવા માટે ભલામણો લાવવી પડે છે અને ધક્કા ખાવા પડે છે. અંતે તો ફરિયાદીને અરજીથી સંતોષ માણવો પડે છે. જ્યારે કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ ખુલ્લો આક્ષેપ કરતાં કહ્યું હતું કે ભાજપના ધારાસભ્ય इमिशनर पर आक्षेप इरे अने तेमना જ સાંસદ સમર્થન આપે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાને જાગ્રત કરવા ધરણાં પર બેસે એ પહેલાં આ પ્રકરણ દબાવવા કાર્યકર્તાની ધરપકડ કરે તો કેટલું યોગ્ય કહેવાય.

#### ਮੁਕਿਤਾਨਮਣ ਤੁਨ੍ਯ ਗੇਟੀસ

OICICI Bank રાખાનું સરનામું : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓફીસ નં. ૨૦૧-બી, બીજો માળ, રોડ નં.૧, બોટના માર્ગ છે. નં.૧ હાગલે ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે, મહારાષ્ટ્ર -૪૦૦૬૦૪.

કમ નં.	દેવાદારોનું નામ / લોનનો ખાતા નંબર	મિલકતોની વિગતો / પ્રતિકાત્મત કબ્જાની તારીખ	ડિમાન્ડ નોટીસની તારીખ/ડિમાન્ડ નોટીસમાંની ૨કમ(રૂા)	શાખાનું નામ
٩	વર્ષાલિબેન કનુભાઈ ઈટાલિયા અને કનુભાઈ બાબુભાઈ ઈટાલિયા LBSUR00004974244	કલેટ નં.ડી/ ૫૦૧, શાલિગ્રામ કલોરા, ડાયમંડ નગર સામે, પસોદરા પાસે, સુરત, ગુજરાત -૭૯૫૦૦૬/ કેલુઆરી ૪, ૨૦૨૨	જુલાઈ દ, ૨૦૨૧ રૂા. ૫,૦૫,૪૬૧.૦૦/-	સુરત
ર	ઉપાબેન દિલીપભાઈ ગોહિલ અને દિલિપભાઈ મોહનભાઈ ગોહિલ LBSUR00004311062	કલેટ નં.૨૦૪, એર, સ્ટારપવિત્ર નગરી બિલ્ડિંગ બીવ, એચવ, એચર, એચ૩, બીજો માળ, ખોલવડ, ૩૦૫, ગુજરાત, સુરત-૩૯૪૧૯૦/ કેબ્રુઆરી ૪, ૨૦૨૨	જુન ૨૫, ૨૦૨૧ ટ્રા. ૮,૮૮,૩૨૪.૦૦/-	સુરત
3	નરેશ નારણભાઈ વાઘમશી અને નિતાબેન નરેશભાઈ વાઘમશી LBSUR00005054000 & LBSUR00005334480	શોપ નં. ૪૦૪, રાજવી શોપિંગ, શાંતિવન સોસાયટી-૨ સામે, કવિતા રો- હો પાછળ, મોજે-સરશાલા, પ્લોટ નં. પર શ્રી ૧ ૮, અપરએસ નં. ૧ પદ/ ૨, ૧૫૯, ૧૧ ૧/, ૧૧૨ અને ૧૮૦ પૈકી, બ્લોક નં. ૧૫૪, ૧૫૫, ૧૧૫ અને ૧૩, ટીપી સ્ક્રીમ નં. ૨, એકપી મં. ૧૦/એ અને ૧૦/બી, ગુજરાત, સુરત-૩૯૫૦૧૦/કેબ્રુઆરી ૪, ૨૦૨૨	ઓગષ્ટ ૨૭, ૨૦૨૧ રૂા. ૪૪,૫૨,૭૭૨.૦૦/-	સુરત
γ	દિપેશકુમાર ધિરજલાલ પટેલ અને આશા દિપેશ પટેલ અને ધિરજલાલ માલવિયા-LBSUR00002897402 & LBSUR00004347070	પ્લોટ નં.૩, પ્રભુનગર સોસાયટી-૨ તરીકે જાણીતી, કતારગામ દરવાજા, જમીન માપશી સર્વે નં.૪૫૫ અને ૪૫૬/ ઉપર કતારગામ સ્થિત, સિટી સર્વે વોર્ડ કતારગામ સ્થિત, સિટી સર્વે વોર્ડ કતારગામ સ્થિત, સિટી સર્વે વોર્ડ કતારગામ, ઢ્લેરનગર પાસે, વેદ રીડ.ગુજરાત, સુરત-૭૯૪૫૪૦/ કે બ્રુઆરી ૪, ૨૦૨૨	જુલાઈ ૨૦, ૨૦૨૧ ટ્રા. ૪૪,૯૧,૪૫૪.૦૦/-	સુરત
પ	છગનભાઈ આર. મુંગલપરા અને મનિયાબેન સી. મુંગલપરા LBSUR00002172737	કલેટ નં.એ૧૪-જી૪, ગ્રાઉન્ડ ફ્લોર, ઓમ ટાઉનશીપ-૩, ઓમ ટાઉનશીપ-૧ સામે, પસોદરા ગામ પાસે, કામરેજ, એસ નં.૧૭૬, ગુજરાત સુરત-૩૯૫૦૦૬/ કેબ્રુઆરી ૪, ૨૦૨૨	જુન ૨૫, ૨૦૨૧ રૂા. ૬,૬૦,૬૦૩.૦૦/-	સુરત
u,	હેમંત રમેશભાઈ પટેલ અને હેતલ હેમંત પટેલ LBSUR00002850558	કલેટ નં.એ-૧૨૦૮, બારમો માળ, ટાવર-ઓપલ, સનશાઇન સિટીની બાજુમાં, અલવર બાય પાસ રોડ, ખાસરા નં.૪૫૯, ૪૬૦, ૪૬૨, ૪૬૩, ૪૬૬ થી ૪૬૮, ૪૭૦, ૪૭૫ થી ૪૮૨ અને (૪૪૪, ૪૬૯ ભાગ) ગામ-સૈદપુર (બિવાડી)- રાજસ્થાન, (બિવાડી - ૩૦૧૦૧૯ / કેબ્રુઓરી ૪, ૨૦૨૨	મેં ૨૯, ૨૦૨૧ ફા. ૩૬,૪૯,૮૯૮.૦૦/-	સુરત

ઉપર જુણાવલા કરજદાર(રા)/ જુમીનદાર(રા)અહી બાકી નાણા પરત કરી જુવા માટે 30 દિવસની નાટીસ આપવામાં આવલ છે, જો નાણાં પરત કરવામાં નહીં આવે તો સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્કોસંમેન્ટ) રુલ- ૨૦૦૨ની કલમ ૮ અને ૯ નીજોગવાઈ અજબ જુમીન તરીકે ઘટેલી ઘિલ્ડનો આ નોરીસ પશ્ચિત થયાનાં ૨૦ દિવસ બાદ તેગી દેવામાં આવશે

અધિકૃત અધિકારી બાઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ

#### જશે. રાજકોટની કાર્યદો અને સમ્રગ દેશમાં રાજકોટમાં ક્રાઈમ રેટ

લખાન કહ્યું કે, સામાન્ય રાત તા લોકોના રક્ષક તરીકે પોલીસતંત્રનું પ્રજામાં માન, સન્માન હોય છે અને હોવું પજ્ઞ જોઈએ પરંતુ રાજકોટમાં અમુક અધિકારીઓનું આગમન થયા બાદ કંઈક અલગજ સ્થિતિનું નિર્માણ પામ્યું છે અને તેનો રાજકોટની મોટાભાગની પ્રજાને કડવો અનુભવ થયો જ હશે. ક્રાઈમરેટ ઘટાવડાના ચક્કરમાં સામાન્ય લોકોને ફરિયાદ નોંધાવા માટે ભલામણો અને ધક્કાઓ ખાવા પડે અને અંતે તો ફરીયાદીને અરજીઓથી સંતોષ માણવો પડે એના પરથી સ્પષ્ટ કહી શકાય કે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કેટલી હદે કથળી છે. જો સત્તાધારી પક્ષના ધારાસભ્યને સરકારના ગહવિભાગને પારાસભ્યા સરકારમાં ગૃહાવનાગમ ફરીયાદ નોં ધવા ભલામણ કરવી પડતી હોય તો સામાન્ય લોકોની હાલત શું હશે એ વિચારી પણ ના શકાય! આજે રાજકોટની જનતાની સુરત, સુરતમાં રાંદેર પાલનપુર પાટીયા નજીક એક યુવાન સિક્લુરિટી ગાર્ડને રાપ્યુ ધુસાડી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રવિના મામાએ કહ્યું કે, મજબૂરી એ છે કે એ મોટાભાગના લોકો હવે પોલીસ ફરીયાદો કરવાનુ જ ટાળે છે. અમુક ઉપરી અધિકારીઓની સૂચનાથી મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં માત્ર ਪੈਮਾ ਅਜੇ ਪ੍ਰਮਿਫ਼ੀ ਮੁਯੁਰੀ ਫ਼ੀਪ ਰੇਹੀ જ ફરિયાદ નોંધવામાં આવે છે હવાલા કબાલાઓ, વ્યાજખોરોનો હવાલા કળાલાઓ, વ્યાજગારાના આંતક, બુટલેગરો, ચીટરો, ગુનેગારો, બેફામ ભુમાફીયાઓને ડામવાનું પોલીસનું મુખ્ય કામ હોય છે. પરંતુ જમીનની વાસ્તવિકતા કહેતા શરમ આવે છે કે અહીયાની સ્થિતિસાવઊંધી છે. અમુક ભાજપના નેતાઓના કહેવાથી અને પોલીસ પૈસા માટે આવા તમામ ગુનેગારોને છાવરે છે અને સામાન્ય જનતા અત્યંત પીડાય છે. આ વાત અમે જ નહીં પરંતુ શાસકપક્ષના સાંસદસભ્ય. ભ્ય અને કોર્પોરેટરોએ દોહરાવી છે. હાર્દિક આગળ કહે છે જો રાજ્ય-સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી રાજકોટ્માં જમીન .... ાચાવી પાડવાના કિસ્સાઓ, સાટાગટ

પશ્ચિમ રેલવે – અમદાવાદ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ (કન્સ્ટ્રેક્શન) ડિઝર્ટ એર્કલર ભાડે રાખવા ઈ-રેન્ડ નોટિસ ને: ELYCADYGS/45/ િક્રમ્ટ એન્ડ્રેક્ટ્રલ ભારે સાધવા ઇ-રેન્ડ નાર્મિક નાં કાઇટ્રસાઇલ્ટરાઇન્ટ્રસ 2002 રા. (1) કામનું નામ તેના સ્થળ સાથે દાઇ/ભારાદ્વાર હતા. (2) કામનું કામનુ

પોલીસની ભૂંડી ભુમિકા, પૈસા પચાવી પાડ્યા હોયતો હવાલા લેવા, હથિયારના લાઈસન્સમાં પૈસા તોડવા, ફરિયાદ ના નોંધવાના, આરોપીને માર ન મારવાના જેવા મોટા કિસ્સાઓમાં પોલીસ વિરુદ્ધ સાચી દાનતથી ખુદ ગૃહમંત્રી રાજકોટની જનતાને અપીલ કરી લોકદરબારનું આયોજન કરે તો લાક્કરનારનું આવા કર્યા ફરિયાદોના રાફડો ફાટે અને અનેક પોલ છતી થશે અને ભ્રષ્ટ અમુક પોલીસ અધિકારીઓ ખુલ્લા પડી જ્યાં. રાજકાટના કાયરા જ માના સમય હતાના ધરકાટ વ્યવસ્થાની સુસ્થિતિ સંભાળવાની ઓછો છે. પંસ્તુ વાસ્ત જેની જવાબદારી હોય તેવા મુખ્ય કાઈમરેટ ગુજરાતમાં જવાબદાર વ્યક્તિ એટલે પોલીસ તો નક્કી ના કહેવાય.

નો કરી પરથી આવ્યા બાદ ઘરેથી

વિધવા માતા પાસે ૫૦ રૂપિયા લઈને નીકળેલો રવિ ૧૦ મિનિટમાં આવું

ભાજપના કાર્યકર તરીકે જ કામ કર્યું છે અને સત્તાનો દુરુપયોગ કરી એની ટોળકીએ રાજકોટની જનતાને લૂંટાવનું કામ કર્યુ છે. વિરોધપક્ષના આગેવાનો સામે ખોટી ફરીયાદો કરી ફસાવવા, દબાવવાનું કામ તેમજ ભાજપના ઇશારે અને પોલીસની મીઠી નજર હેઠળ જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાનબુથો પર ઈવીએમ તોડી ભય પેદા કર્યો હતો અને એ અસામાજીક તત્વો આજે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. સરકારી રેકોર્ડ પ્રમાણે કાગળ પર જ સંત્રળ દરાના સહકાટના ક્રાઇન સ્ટ ઓછો છે. પંરતુ વાસ્તવિક રાજકોટમાં ક્રાઈમરેટ ગુજરાતમાં સૌથી વધુ હોય

સુરતમાં ઘરેથી બહાર ગયેલા પુત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ સુરત, સુરતમાં રાંદેર પાલનપુર પાટીયા નજીક એક યુવાન સિક્શુરિટી પિતાના અવસાન બાદ વિધવા લેગ મુજ અને માતા પાસે પ૦ આઈન ચપ્યુ સુસારીમાનો વાદ હતા થી. ધાતાનો આવાન માટે કૃષ્યાલ લે ૦૦ મિતિટમાં આવે છું. નામ વકુ પાસે રવીનો કોઈ દ્વાયો હોવાનો બનાવ સામે આવ્યો રવિએ સિક્શુરિટી ગાર્ડના નોક્શ શરૂ કહીને ગયો હતો. ૩૦ મિતિટ બાદ રવિએ સિક્યુરિટી ગાર્ડની નોકરી શરૂ કરી હતી. મોટો દીકરો હોવાથી ઘરની બધી જ જવાબદારી એના પણ આવી ગઈ હતી. એક નાનો ભાઈ અને ખાનગી હોસ્પિટલમાં આયા તરીકે

કહીને ગયો હતો. ૩૦ મિનિટ બાદ માતાએ એને ફોન કરી સંપર્ક કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે થોડીવાર પછી મિત્રોએ ફોન પર જાણ કરી હતી કેરવિની હત્યા થઈ ગઈ, આ છું કહીને ગયો હતો અને પોસ્ટમોર્ટમ કામ કરતા વિષવા માતાને મોડી રાત્રે સાંભળી આખું પરિવાર રડતું થઈ ગયું રૂમમાં આવીને સુઈ ગયો, ખબર હોસ્પિટલમાંથી આવેલા છોન પર જાણ હતું. ૧૦ મિનિટનું કહીને ગયેલા રીવે નહીં કોની નજર લાગી. રાદેર કરાતા આખું પરિવાર શોકમાં ગરકાવ પોસ્ટમોર્ટમમાં આવીને સુઈ જશે એની પોલીસે હત્યાનો ગુનો નોંપી થઈ ગયું હતું. વધુમાં જજ્ઞાવ્યું હતું કે ખબર ન હતી નહિતર જવા ન દીધો

નામના યુવક પાસે રવીનો કોઈ બાબતે ઝઘડો થયો હતો ત્યારે અક્ષયે રવિને લોખંડના સળિયા વડે ઢોરની જેમ ફટકાર્યો હતો. પોલીસે લગભગ પૂછપરછ માટે અક્ષયની અટક કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રવિનો હત્યારો અને હત્યા પાછળનં કારણ ૧૨ કલાક બાદ પણ હજ તપાસ હાથ ધરી છે.

#### **PUROHIT CONSTRUCTION LIMITED**

CIM: L45200G11991PLC015878

REGD.OFFICE:401,PUROHIT HOUSE,OPP:STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009

Telephone Number- 079-26426486, Emai Id: cs@purohitconstruction.com

						(Rs. in	Lakh except EPS
ı				nths ended	Nine Mon	Year ended	
١	SI. No.	Particulars	31/12/2021	31/12/2020	31/12/2021	31/12/2020	31/03/2021
١			(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
ı	1.	Total Income from Operations	0.000	0.267	0.116	4.585	14.556
	2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items# )		(28.128)	(59.617)	(165.686)	(117.750
l	3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(16.371)	(28.128)	(59.617)	(165.686)	(187.501
	4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items# )	(16.491)	(27.922)	(59.980)	(165.732)	(187.565
	5.	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(16.491)	(27.922)	(59.980)	(165.732)	(187.565
	6.	Equity Share Capital (Equity Shares of Rs.10/-Each)	440.560	440.560	440.560	440.560	440.560
		Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.000	0.000	0.000	0.000	(53.150
		Earnings Per Share (Face Value of Rs. 10/- each ) (for continuing and discontinued operations) -					
		1. Basic:	(0.374)	(0.634)	(1.361)	(3.762)	(4.257
		2. Diluted:	(0.374)	(0.634)	(1.361)	(3.762)	(4.257
1	Notor:						

On 68.02.2022.

The above result for the quarter and Nine Months ended on 13.1.2.2021 has been prepared in accordance with the Companies (Indian According Standards) Rules 201 (Ind AS), prescribed under section 133 of the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

The Limited Rejective of Unaudidate Trainingal Results for the Quarter and Nine Months ended Describer 31, 2021 as required in terms of Clause 33 of SEBI (LODR

ry. on the website of BSE (www.bseindia.com

Iso on the website of BbE (www.use.nem...)

For and on behalf of the Board of Directors NARENDRA M. PUROHIT (Chairman & Managing Director) DIN:00755195

#### CRESTCHEM LIMITED

CIN: L24100GJ1991PLC015530 Regn Office Address: Sr. No.550/1, Sub Plot No. 12, Village- Indrad, Taluka- Kadi, Mahesana- 382715

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31st DECEMBER, 2021
(Rs in Lacs 31.12.2021 30.09.2021 31.12.2020 31.12.2021 31.12.2020 31.03.2021 31.03.2020 0.56 120.23 416.07 120.23 416.07 510.52 620.4 1.61 1.33 5.00 3.83 2.17 121.56 421.07 514.35 (0.1 21.5 Earning per equity share (EPS) in ` (not Annualised)

Notes:

(1) The Financial Results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) as prescribed under section 133 of Companies Act,2013 read with Rule 3, of the Companies (Indian Accounting Standards) Rule 2013 and Relavent Amendments thereauxies.

2015 and Relavent Amendments thereauxies.

2016 and Amendments and West Eaken on second by the Board of Directors in their respective mentings held on 8th February, 2012 and a Limited Review of the save neared by the Audit Committee and were taken on neared by the Board of Directors in their respective mentings held on 8th February, 2012 and a Limited Review of the above results as per Regulations 3 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

(1) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(1) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(2) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(3) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(4) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(5) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(6) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(7) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(8) The Company operates only in one segment via. Whitthion: Chemical Indiatives.

(9) The Company operates one of the Standard Via of the Company operates one of the company situation of the company operates of the company

By order of Board of Directors For Crestchem Limited Dipak Patel Managing Director (DIN - 02052080)

Place : Indrad, Kadi Date: 8th February, 2022

## Gujarat: Over 63 lakh register on state portal for unorganised sector workers



63 lakh workers from the unorganised sectors spread across 150 sub-sectors in across 150 sub-sectors in Gujarat have registered in the e-Shram portal as on January 31. Of the total registrations, males constitute 54 per cent and the rest are females. While agriculture emerged as the prominent sector for the uncranifed workers in

as the prominent sector for the unorganised workers in Gujarat, the website has also seen registrations from the likes of wig makers, agarbatti makers, band baaza players, piano tuners, snake charmers and bidi checkers, among others

and bidl checkers, among others.

The rural areas in the state have dominated the registrations in the past four months compared to the urban centres. The e-gram centres and Sewa Kendra centres in rural areas are stronger compared to the Common Service Centres (CSCs) in the urban areas. Though the CSCs, too, picked up later, the registrations in the urban areas are lower as more awareness needs to be spread in slum areas. Urban centres also do not have a centres also do not have a target group and less

#### Dharna over attack on student

Surat: Members of Akhil Bharatiya Vidhyarthi Parishad (ABVP) held dhama at K P Commerce College on Saturday raising slogans and submitted a memorandum to the college on Granding action against those involved in attacking a 17-year-old student. Police bandobast was installed on the campus to ensure peaceful representation. Members of the outfit later went to Veer Namad South Gujarat University (NrSGU) and submitted a memorandum to the vice-chancellor K N Chavda. They staged a dhama in the lobby of the university administrative. stages a final in all the body in the university administrative building as well. On Friday, a group of students along with the victim had gone to the Umra police station alleging that he was thrashed by some people from the minority community for his social media nost.

media post.
Police registered an offence of attack and claimed that the post was deleted by the victim. Due to the nature of the incident, senior police officials too reached Umra police station on Friday to question the victim.

Place : Ahmedabad Date : 8 February 2022

The e-Shram portal, by the Ministry of Labour and Employment and handed over to respective state governments, was launched workers, among others. According to the state government records and that maintained by the Ministry (workers, among others. According to the state government records and that maintained by the Ministry (workers, among others. According to the state government records and that maintained by the Ministry of Labour and Employment, of the 15 sectors of occupation, the gap between the top two —agriculture vs domestic and household — is as wide as nine times in Gujarat. The portal is the answer to the need for a database of since times in Gujarat. The portal wist that the domestic and household sectors. In the portal with the faz. 66 lakh registrations in Gujarat, those earning is Gujarat has a registered unorganised vow for the fill there are nearly \$50,000 on the state government (some the day of the community wise, the share is highest to show the same only 1.5 per cent. Workers of Labour and Employment, of the 15 sectors of occupation, the gap between the top two —agriculture vs domestic and household — is as wide as nine times in Gujarat. The portal wise in the gare the category who was the community of Labour and the portal with the faz. 61 lakh in the domestic and household sectors. Linking the portal with various existing as well as tuture schemes of the state domestic and household sectors. Linking the portal with various existing as well as tuture schemes of the state domestic and household sectors. Linking the portal with various existing as well as tuture schemes of the state domestic and household sectors. Linking the portal with various existing as well as tuture schemes of the state domestic and household sectors. Linking the portal with various existing as well as tuture schemes of the state of the st

#### **CRESTCHEM LIMITED**

CIN: 124100G1991PLC015530

Regn Office Address: Sr. No.550/1, Sub Plot No. 12,
Village: Indrao, Talkuk: Asid, Mahesana: 382715

UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31st DECEMBER, 2021

(Rs in Lace)

		STANDA	ALONE FINANCI	ALS				
SI		q	uarter ended			nth Ended	Year ended	Year ended
Nº		31.12.2021	30.09.2021	31.12.2020	31.12.2021	31.12.2020	31.03.2021	31.03.2020
		Un-audited	Un-audited	Un-audited	Un-audited	Un-audited	Audited	Audited
1								
	Revenue from operations	266.80	0.56	120.23	416.07	510.52	764.17	620.45
	Other Operating income		-	-				
	a) Total Income from Operations ( net)	266.80	0.56	120.23	416.07	510.52	764.17	620.45
	b) Other income	1.80	1.61	1.33	5.00	3.83	5.42	2.50
Г	Total Income (a+b)	268.60	2.17	121.56	421.07	514.35	769.59	622.95
12	Expenses							
	a) Cost of Material Consumed	211.18	0.48	93.15	324.87	396.47	581.52	488.77
	b) Purchase of Stock-in-Trade			-	-		-	
	c) Changes in Inventories of Finished Goods, Work-in-	0.25	(0.01)	0.11	0.23	0.16	0.32	(0.18)
	progress and stock-in-trade							
	d) Employee benefits expense	7.01	2.25	6.02	16.25	16.11	46.54	12.92
	e) Finance Costs	0.43	0.29	0.34	1.40	0.88	1.61	0.49
	f) Depreciation & amortization expenses	0.65	0.65	0.67	1.95	1.71	2.39	2.04
	g) Other Expenses	17.41	3.88	20.32	35.55	61.81	69.88	61.95
	Total Expenses (a+b+c+d+e+f+g)	236.92	7.54	120.61	380.24	477.14	702.26	565.99
	Profit before Tax (1-2)	31.68	(5.37)	0.95	40.82	37.21	67.33	56.96
4	Tax Expenses							
	(i) Current Tax	9.41	(0.83)	0.25	10.84	9.73	10.51	8.69
	(ii) Deferred Tax	0.73	(0.07)	(4.79)	0.58	(2.39)	(0.59)	3.89
	Total Tax ( i+ii)	10.14	(0.90)	(4.54)	11.42	7,34	9.92	12.58
5	Profit for the period (3-4)	21.54	(4.47)	5.49	29.40	29.87	57.41	44.38
	Other Compehensive Income						-	
7	Total comprehensive income for the period (5+6)	21.54	(4,47)	5.49	29,40	29.87	57.41	44.38
	(Comprising Profit/(Loss) and other Comprehensive income							
	for the period)							
8	Paid- up Equity share Capital -Face Value of `10 each.	300.00	300.00	300.00	300.00	300.00	300.00	300.00
5								
	BASIC	0.72	(0.15)	0.18	0.98	1.00	1.91	1.48
L	DILUTED	0.72	(0.15)	0.18	0.98	1.00	1.91	1.48

Notes:

| Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | Notes: | No

Managing Director (DIN - 02052080)

Place : Indrad, Kadi Date: 8th February, 2022

**PUROHIT CONSTRUCTION LIMITED** 

CIN: 1.45200G31991PLC015878
REGD.OFFICE:401,PUROHIT HOUSE,OPP:STADIUM, NAVRANGPURA, AHMEDABAD-380 009
Telephone Number: 079-26426486, Emai Id: cs@purohitconstruction.com

					(Rs. in	Lakh except EPS
SI. No.	Particulars	Three Mor 31/12/2021 (Unaudited)	nths ended 31/12/2020 (Unaudited)	Nine Mon 31/12/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	Year ended 31/03/2021 ( Audited)
1.	Total Income from Operations	0.000	0.267	0.116	4.585	14.5
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items# )	(16.371)	(28.128)	(59.617)	(165.686)	(117.7
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	(16.371)	(28.128)	(59.617)	(165.686)	(187.5)
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	(16.491)	(27.922)	(59.980)	(165.732)	(187.5
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(16.491)	(27.922)	(59.980)	(165.732)	(187.5
6.	Equity Share Capital (Equity Shares of Rs.10/-Each)	440.560	440.560	440.560	440.560	440.5
7.	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.000	0.000	0.000	0.000	(53.1
8	Earnings Per Share (Face Value of Rs. 10/- each ) (for continuing and discontinued operations) -					
	1. Basic:	(0.374)	(0.634)	(1.361)	(3.762)	(4.2
	2. Diluted:	(0.374)	(0.634)	(1.361)	(3.762)	(4.2

- rus.

  The Above Financial Results have been reviewed by the Audit committee and approved by the Board of Directors of the Company at their respect
- The Above Financial Results have been reviewed by the Audit committee and approved by meetings held On 80.2 2022.

  The above result for the quarter and Nine Months ended on 31.12.2021 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards).

  The Limited Review of Unaudited Financial Results for the Companies Act 2013 and other recognized accounting practices and policies to the extent applicable.

  The Limited Review of Unaudited Financial Results for the Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Clause's 30 of SEBI Counter (Counter and Nine Months ended December (Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Counter and Nine Months ended December 31, 2021 as required in terms of Counter and

d Nine Months enues a vocaassified and restated wherever necessary,
sasified and restated wherever necessary,
www.purchitconstruction.com and also on the website of BSE (www.bseindia.com)
For and on behalf of the Board of Directors
For and on behalf of the Board of Directors
(Chairman & Managing Director)
DIrhot0755195

#### Dhandhuka murder: 3 accused in police remand for 10 more days

Ahmedabad : A magisterial remand. The Gujarat Anticourt in Dhandhuka of Terrorist Squad (ATS), which
Ahmedabad Saturday sent is investigating the murder Dhandhuka resident, was murder was carried to the tree main accused in the
case, claimed that it is probing a list of 10 persons created by bike-borne men in the town on to more days in police the arrested accused who had January 25 when he was post by Bharwad.



#### STERLING GREENWOODS LIMITED

CIN: -L51100GJ1992PLC017646

Regd Office: - 25, Sunrise Centre, Opp. Drive-in-Clnema, Thaltej, Ahmedabad – 380054
Telephone No: +91-79-26851680/26850935 Email Id: info@sterlinggreenwoods.con

l											(Rs. In Lakh except Per share data)						
				STAND.	ALONE		CONSOLIDATED										
	Particulars		Quarter	Ended	9 Month	Ended	Year ended		Quarter	Ended	9 Month	Ended	Year ended				
		31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021	31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021				
Α	Date of start of reporting period	01-10-2021	01-07-2021	01-10-2020	01-04-2021	01-04-2020	01-04-2020	01-10-2021	01-07-2021	01-10-2020	01-04-2021	01-04-2020	01-04-2020				
В	Date of end of reporting period Whether result are audited or unaudited	31-12-2021 (Unaudited)	30-09-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-12-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-03-2021	31-12-2021 (Unaudited)	30-09-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-12-2021 (Unaudited)	31-12-2020 (Unaudited)	31-03-2021				
C D	Whether result are audited or unaudited Nature of report standalone or consolidated	(Unaudited) STANDALONE	(Unaudited) STANDALONE	(Unaudited) STANDALONE	(Unaudited) STANDALONE	(Unaudited) STANDALONE	(Audited) STANDALONE	(Unaudited) Consolidated	(Unaudited) Consolidated	(Unaudited) Consolidated	(Unaudited) Consolidated	(Unaudited) Consolidated	(Audited) Consolidated				
ט	-																
	(a) Net Sales/Income from	53.20	30.67	44.67	110.66	175.70	214.82	53.20	30.67	44.67	110.66	175.70	214.82				
Щ	(b) Other operating income	9.78	4.82	11.94	19.22	23.98	40.06	9.78	4.82	11.94	19.22	23.98	40.06				
	Total Income from operations Expenses	62.98	35.49	56.61	129.88	199.68	254.88	62.98	35.49	56.61	129.88	199.68	254.88				
-	(a) Cost of material and Land	10.66	8.44	5.51	22.27	8.42	15.04	10.66	8.44	5.51	22.27	8.42	15.04				
	(b) Purchase of stock-in-trade	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
	(c) Scheme development expenses	0.72	0.75	0.78	1.96	1.47	2.36	0.72	0.75	0.78	1.96	1.47	2.36				
Н	( d) Changes in inventories of	Nil	0.11	0.15	0.11	1.23	13.61	Nil	0.11	0.15	0.11	1.23	13.61				
	finished goods, work-in-progress and																
	stock in trade																
Н	(e) Employee benefit Expenses (f) Finance Costs	22.85 6.81	7.39	19.61 26.54	87.84 22.78	47.02 80.80	70.96 34.98	22.88 6.81	22.15 7.39	19.63 26.54	87.93 22.78	47.08 80.80	71.06 35.00				
Н	(g) Depreciation and amortisation	14.28	14.27	11.67	42.83	35.01	57.10	14.28	14.27	11.67	42.83	35.01	57.10				
	(g) Depreciation and amortisation expenses	14.28	14.27	11.67	42.83	35.01	57.10	14.28	14.27	11.67	42.83	35.01	57.10				
	(h) Other expenses	32.92	21.00	25.93	73.18	58.68	97.79	32.94	21.01	25.96	73.23	58.77	98.78				
	Total Expenses	88.24	74.08	90.19	250.97	232.63	291.84	88.29	74.12	90.24	251.11	232.78	292.95				
3	Profit / (Loss) before exceptional Items extraordinary items and tax (1-2)	(25.26)	(38.59)	(33.58)	(121.09)	(32.95)	(36.96)	(25.31)	(38.63)	(33.63)	(121.23)	(33.10)	(38.07)				
4	Exceptional items	Nil	Nil	0.03	Nil	(2.50)	Nil	Nil	Nil	0.03	Nil	(2.50)	Nil				
5	Profit / (Loss) before extraordinary	(25.26)	(38.59)	(33.55)	(121.09)	(35.45)	(36.96)	(25.31)	(38.63)	(33.60)	(121.23)	(35.60)	(38.07)				
5	items and tax (3-4)																
6	Extraordinary Item (net of tax	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
7	expenses) Profit / (Loss) before tax (5-6)	(25.26)	(38.59)	(33,55)	(121.09)	(35.45)	(36,96)	(25.31)	(38.63)	(33.60)	(121.23)	(35.60)	(38.07)				
	Tax expense	(23.20)	[30.37]	[33.33]	(121.09)	(33.43)	(30.70)	[23.31]	[30.03]	(33.00)	(121.23)	(33.00)	[30.07]				
	Prior Period Tax	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
	Cuurent Tax	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
	Mat Credit Entilement	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
Н	Deferred Tax Profit / (Loss) for the period from	Nil (25.26)	Nil (38.59)	Nil (33.55)	Nil (121.09)	Nil (35,45)	5.73	Nil (25.31)	Nil (38.63)	Nil (33,60)	Nil (121.23)	Nil (35.60)	5.73				
9	continuing operations (7-8)	(23.20)	(30.37)	(33.33)	(121.09)	(33.43)	(31.23)	(23.31)	(30.03)	(33.00)	(121.23)	(33.00)	(32.34)				
	Profit / (Loss) from discontinuing	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
10	operations Before tax																
	Tax expense of discontinuing	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
11	operations	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
	Profit / (Loss) from discontinuing	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
12	operations after tax (10-11)																
13	Profit/(Loss) before minority	(25.26)	(38.59)	(33.55)	(121.09)	(35.45)	(31.23)	(25.31)	(38.63)	(33.60)	(121.23)	(35.60)	(32.34)				
13	interest																
14	Share Profit /(Loss) of Associates	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
15	Minority Interest #	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	(0.01)	(0.01)	(0.01)	Nil	(0.05)				
16	Profit/(Loss) fot the period (13-14-	-25.26	-38.59	-33.55	-121.09	-35.45	-31.23	-25.31	-38.62	-33.59	-121.22	-35.60	-32.29				
10	15)																
17	Net Profit from continuing operations for the period attributable to :																
Н	( a ) Shareholders of the company	-25.26	-38.59	-33.55	-121.09	-35.45	-31.23	-25.31	-38.62	-33.59	-121.22	-35.60	-32.29				
	(b) Non controlling interests	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	(0.01)	(0.01)	(0.01)	Nil	(0.05)				
18	Other Comprehensive Income/(Expenses)	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
16	(OCI)																
	Items that will not be reclassified to profit or loss in subsequent periods	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
Н		Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil	Nil				
	Other Comprehensive Income/(Expenses)																
19	Total Comprehensive income for the	-25.26	-38.59	-33.55	-121.09	-35.45	-31.23	-25.31	-38.62	-33.59	-121.22	-35.60	-32.29				
-	period Paid-up equity share capital	423.96	423.96	423.96	423,96	423.96	423.96	423.96	423.96	423.96	423,96	423.96	423.96				
20	(Face value of Rs. 10 each)	<b>423.90</b>	<b>423.70</b>	-23.70	<b>423.70</b>	423.70	-23.70	423.90	<b>423.70</b>	<b>423.70</b>	-£3.70	¥23.90	₹23.70				
	Earnings Per Share (before																
21.i	extraordinary items) (of Rs. 10/- each) (not annualised)											l					
	Basic & Diluted	(0.60)	(0.91)	(0.79)	(2.86)	(0.84)	(0.74)	(0.60)	(0.91)	(0.79)	(2.86)	(0.84)	(0.76)				
	Earnings Per Share (After																
21.ii										1		l					
Н	each) (not annualised) Basic & Diluted	(0.60)	(0.91)	(0.79)	(2.86)	(0.84)	(0.74)	(0.60)	(0.91)	(0.79)	(2.86)	(0.84)	(0.76)				
_	onan w offuteu	[0.00]	[0.91]	[0./9]	[2.80]	[0.84]	[0.74]	[0.00]	[0.91]	[0./9]	[2.80]	[0.84]	[0.76]				

applicable in the case of consolidated results

certaining to previous periods have been regrouped, reclassified and restated whereever necessary, entwise Revenue, Results and capital employed along with the quarterly and Half Year ended results

		STANDALONE					CONSOLIDATED						
Particulars			Quarter	Ended	9 Month	Ended	Year ended		Quarter	Ended	9 Month	Ended	Year ended
		31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021	31-12-2021	30-09-2021	31-12-2020	31-12-2021	31-12-2020	31-03-2021
	Segment Revenue												
	Real Estate Business	8.87	4.82	17.42	24.32	147.81	163.81	8.87	4.82	17.42	24.32	147.82	163.81
	Resort Business	54.11	30.67	39.19	105.56	51.87	91.07	54.11	30.67	39.19	105.56	51.86	91.07
	Total	62.98	35.49	56.61	129.88	199.68	254.88	62.98	35.49	56.61	129.88	199.68	254.88
	Less: Intersegment Revenue	0	0	0	0	0	0	0	0	0	0	0	0
	Net Sales/Income from Operations	62.98	35.49	56.61	129.88	199.68	254.88	62.98	35.49	56.61	129.88	199.68	254.88
	Segment Result												
	Profit/(Loss) before tax and interest from	om segment											
	Real Estate Business	-9.80	-12.75		-53.59	90.61	63.94	-9.85	-12.79	-3.53	-53.73	90.46	62.85
	Resort Business	-8.65	-18.45	-3.53	-44.72	-45.26	-65.92	-8.65	-18.45	-3.53	-44.72	-45.26	-65.92
	Total	-18.45	-31.20	-7.01	-98.31	45.35	-1.98	-18.50	-31.24	-7.06	-98.45	45.20	-3.07
	Less : i. Interest (Net)	6.81	7.39	26.54	22.78	80.80	34.98	6.81	7.39	26.54	22.78	80.80	35.00
	ii. Other Un allocable Expenditure net off	o	0	О	0	0	0	О	o	0	0	0	0
	iii. Unallocable Income												
	Total Profit/(Loss) Before Tax	-25.26	-38.59	-33.55	-121.09	-35.45	-36.96	-25.31	-38.63	-33.60	-121.23	-35.60	-38.07
	Capital Employed (Unallocated)	1642.16	1667.42	1764.75	1642.15	1764.75	1763.24	1635.20	1660.51	1758.91	1635.19	1758.89	1756.42
	Total	1642.16	1667.42	1764.75	1642.15	1764.75	1763.24	1635.20	1660.51	1758.91	1635.19	1758.89	1756.42

NOTES (1). THE ABOVE RESULTS ARE AS PER AS-108 SEGMENTAL REPORTING AND HAVE BEEN REVIEWED BY THE AUDIT COMMITTEE AND APPROVED B THE BOARD OF DIRECTORS OF THE COMPANY ATTHEIR MEETING HELD ON 08TH, FEBRUARY, 2022

Bharatkumar Lekhi Managing Director DIN: 03363339

Place : Ahmedabad Date : 08.02.2022